

આગ પછી: ઘરે સુરક્ષિતપણે પાછા ફરવું

સમુદાય માહિતી

બુશફાયરમાં બળેલા ઘરો, શેડ્સ અને અન્ય મકાનો અથવા માળખાઓ પડેલા ઓબ્જેક્ટ્સ, તીક્ષ્ણ ઓબ્જેક્ટ્સ, અંગારા, ક્ષતિગ્રસ્ત ઇલેક્ટ્રિક વાયર્સ, લીફિંગ ગેસ અને નબળી દિવાલો સહિત સંભવિત સ્વાસ્થ્ય જોખમો ઊડી શકે છે.

આગ પછીની સાવધ રહેવા માટેની જોખમી સામગ્રીઓમાં આ સામેલ છે:

- એસ્બેસ્ટોસ
- રાખ, ખાસ કરીને બળેલા ટ્રીટેડ ટીબ્બર્સમાંથી (જેમ કે કોપર ક્રોમ આર્સેનેટ અથવા 'CCA')
- ધૂળ
- બગીચા અથવા ખેતરનાં રસાયણો
- LP ગેસ સિલિન્ડર્સ
- દવાઓ
- બળેલા ઘરગથ્થું સાધનોમાંની ધાતુ અથવા અન્ય અવશેષો
- અન્ય સામાન્ય રસાયણો (ઉદાહરણ તરીકે, સાફસફાઈના ઉત્પાદનો).

તમારી સ્થાનિક કટોકટીની સેવાઓ વડે તપાસો કે જે તમારા મકાન પર પાછા ફરવા માટે સુરક્ષિત રહેશે. જો સંભવ હોય તો, આગથી ક્ષતિગ્રસ્ત સ્થાયી સંપત્તિઓ પર બાળકોને લઈ જવાનું ટાળો. જો તમે આવું કરતા હોવ, તો ખાતરી કરો કે તેઓ આખો વખત સુરક્ષિત રહે.

તમારું પોતાનું રક્ષણ કરો

સુરક્ષાત્મક કપડા પહેરો, તેની સાથે:

- મજબૂત પગરખા અને હેવી-ડ્યૂટી કાર્ય માટેનાં હાથમોજા
- ડિસ્પોઝેબલ કવરોલ્સ (લાંબી બાહી અને ટ્રાઉઝર્સ સાથેના)
- P2 ચહેરાના માસ્ક્સ.

તમે સુરક્ષાત્મક કવરોલ્સ, હાથમોજા અને ચહેરાના માસ્ક્સ ધરાવતી એક કિટ તમારી સ્થાનિક કાઉન્સિલ અથવા કોઈ તાત્કાલિક પુનઃપ્રાપ્તિ કેન્દ્ર મારફતે એક્સેસ કરી શકો છો.

જ્યારે મકાનનું સ્થાન ઊડી રહ્યાં હોવ ત્યારે તમારા હાથમોજા, કવરોલ્સ અને ચહેરાના માસ્કને એક કચરાની થેલીમાં પેક કરો. પ્રદૂષિત કપડા અને વસ્તુઓને કાઢી નાખ્યા પછી તમારા હાથ ધોઈ લો. તમારા શૂઝને ફરીથી પહેરતાં પહેલા સાફ કરી લો.

કચરાનું હેન્ડલિંગ

તમારા મકાનની આસપાસની રાખને ફેલાવવી અથવા હલાવવી અસલામત છે, ખાસ કરીને જો તે સીસીએ-સંસાધિત ટિબ્બર બળેલું હોય. જો તમારા ઘરમાં એસ્બેસ્ટોસ ધરાવતી સામગ્રીઓ હોય અથવા અન્ય માળખું ક્ષતિગ્રસ્ત થયું હોય, તો તે નુકસાનકારક હોઈ શકે છે.

ભોજન

તમામ ખાદ્ય પદાર્થો કે જે આગથી ક્ષતિગ્રસ્ત હોય અથવા ગરમીથી પ્રભાવિત થયા હોય તેમને બહાર ફેંકી દેવા જોઈએ. આમાં નાશવંત અને બિન-નાશવંત ખોરાકનો સમાવેશ થાય છે, ઉદાહરણ તરીકે, કેન્સ અથવા પેકેજ્ડ ખોરાક. પાવર આઉટેજીસ નાશવંત ખોરાકને ઊડી શકે છે જે રેફ્રિજરેશન કરવામાં આવ્યો હોય, તે ખાવા માટે અસુરક્ષિત હશે.

પાણીની ટાંકી

બુશફાયર્સ વિપુલ પ્રમાણમાં ધુમાડો અને રાખ ઉત્પન્ન કરે છે અને તમારી પાણીની ટાંકી કચરા અને રાખથી અથવા મૃત પ્રાણીઓથી પ્રદૂષિત થઈ શકે છે. જો પાણીનો સ્વાદ, દેખાવ અથવા ગંધ અસામાન્ય લાગે તો પાણી પીશો નહીં અથવા તે પ્રાણીઓને પીવડાવશો નહીં.

સેપ્ટિક ટાંકી

તમારી સેપ્ટિક ટાંકી આગમાં નબળી પડી ગઈ હોઈ શકે છે, તેથી તેના પરથી ડ્રાઇવ કરશો કે ચાલશો નહીં. જો તમને શંકા હોય કે તમારી સેપ્ટિક ટાંકી ભૌતિક રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, તો તેને સુધારવા માટે કોઈ પરવાનો ધરાવતા પ્લમ્બરનો સંપર્ક કરો.

તમારી પોતાની કાળજી લો

સુરક્ષા કારણોસર, તમારા મકાન પર ગાળવાનાં સમયને સીમિત કરવાનો પ્રયાસ કરો. જો કે, જો તમે ત્યાં વધુ સમયગાળા માટે રહેશો, તો તમારી સાથે આ લઈ જવાનું યાદ રાખો:

- બોટલબંધ પીવાનું પાણી
- ખાદ્યાન્ન (નાશવંત ખાદ્ય પદાર્થોને ઠંડામાં, કોઈ એસ્કી અથવા ફૂલર બેગમાં રાખવા જોઈએ)
- સનસ્ક્રીન
- ટોપી.

તમારા મકાન પર પાછા ફરવું તણાવપૂર્ણ અને થકવી નાખનારું હોઈ શકે છે. તે મહત્વપૂર્ણ છે કે તમે તમારું પોતાનું ધ્યાન રાખો. તમારી સ્થાનિક સરકારની સહાયતા અને પુનર્સ્થાપના કેન્દ્ર મારફતે નિષ્ણાતની કાઉન્સેલિંગ અને સહાયતા સેવાઓ ઉપલબ્ધ હોય છે.